

Regd. Office: 65/69/2023en Apt., Scheme 1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006 Ph.: (079)26561000 CIN NO: L67120GJ1994PLC022740

To, **BSE Limited** The Listing Department Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai- 400001

SCRIP CODE: 511738

Sub: Newspaper Publication of notice of 29th Annual General Meeting

Dear Sir/Madam,

Pursuant to Regulation 30, 47 read with Part A of Schedule III of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the newspaper advertisements for the publication of notice of 29th Annual General Meeting of the Company in the following newspapers: Free Press (English Newspaper), Lok Mitra (Gujarati Newspaper) dated 03.09.2023.

You are requested to take the same on records.

You are requested to take the above intimation on record and acknowledge the receipt.

Thanking you,

Yours faithfully,

For, Mehta Securities Limited



Mr. Mahesh Moteevaras Company Secretary & Compliance Officer M. No. A63815

India missed the bus for semiconductors due to previous Governments' lack of political vision and strategic clarity: MoS Rajeev Chandrasekhar Today we are 12 generations behind in chip manufacturing technology: MoS Rajeev Chandrasekhar

Skill Development & Entrepreneurship and Electronics & IT Shri Rajeev Chandrasekhar today interacted with the media ahead of the second edition of SemiconIndia Conference which is scheduled to begin tomorrow at Gandhinagar in Gujarat. The minister decades. emphasised the tremendous strides made by the Government under PM Narendra Modi's leadership in

Union Minister of State for that India currently possesses and how the Government is determined to utilise it. "It has been 19 months since we set the ball rolling in the semiconductor ecosystem. There was a lack of

political vision, strategies and there were incompetencies and missed opportunities for

This has held India back from semiconductors. Today, We can achieve in the coming Techade what some rebuilding India's electronics neighbouring nations took 30 ecosystem and pushing the years & USD 200 billion and country to become one of the still failed to achieve," MoS world's fastest-growing Shri Rajeev Chandrasekhar electronics manufacturers. He said. With the increasing also highlighted the significant demand for electronics, digital semiconductor opportunity products and services, the

today's tech-driven world. Shri Rajeev Chandrasekhar said that India is transforming into a major player in the global electronics and semiconductors supply chain.

"The demand for electronics, digital products and services is only intensifying. Electronics is at the core of our lives today and Semiconductors in turn at the core of Electronics. Prime Minister Shri Narendra Modi has rebuilt our Electronics ecosystem and we are one of the world's fastest growing electronics manufacturers. We were almost nothing in

Minister spoke about the core ecosystem and today we are and collaborations with major role of semiconductors in increasingly becoming a big presence in the global value chain for electronics," the Minister added. Tracing the missed opportunities since the 1960s, Shri Rajeev Chandrasekhar pointed out that the previous Governments failed to envision the

importance of а semiconductor ecosystem in India, "India has missed the bus repeatedly on electronics and semiconductors. There was a lack of strategic and political vision and a big dose of incompetence. Fairchild semiconductors, which is the precursor to Intel, came to India in 1957 for a packaging 2014 in the semiconductor unit and we chased them away. That packaging unit went on to become Asia's largest packaging hub in Malaysia.

We set up a fab for silicon ecosystem. and germanium transistors Silicon Valley.

semiconductor companies. The Minister spoke about the lost opportunities saying, "International semiconductor majors wanted to start operations in South India.

Despite hiring experts and setting up a cleanroom, it faced numerous roadblocks. The project eventually moved to China, resulting in the loss of a semiconductor facility and 4,000 jobs for India. Micron, a world major in

the Semiconductor memory space, its \$2.75 Bn ATMP project in Gujarat is expected to create at least 5,000 new direct and 15,000 community jobs." The Government is also making significant strides in building a comprehensive curriculum to nurture talent and is actively supporting startups in the semiconductor "We are constantly partnering with industry to create 85,000 highly talented, skilled global talent. Under SemiconIndia futureDESIGN over 30 semiconductor design startups have been set up in India including some from

ISRO all set to launch first Sun mission

Union Minister of State (Independent Charge) Science & Technology; MoS PMO, Personnel, Public Grievances, Pensions, Atomic Energy and Space, Dr Jitendra Singh said today that after close on the heels of successful Chandrayaan mission, India is ready with the first Sun Mission "Aditya-L1", which ISRO is all set to launch,

most likely on 2nd of September. Addressing a public program in Mainpuri, Dr Jitendra Singh said, with the entire world celebrating India's Chandrayaan mission, the popular interest in the Sun Mission has also increased manifold. Giving full credit to Prime Minister Shri Narendra Modi, the Minister said, all this would not have been possible, if the Prime Minister had not taken the courageous pathbreaking decision of liberating India's space sector from the shackles of the past which no other government had taken the initiative to do. As a result, today, he said, within a short span of four years, ISRO's financial resources have increased, the number of StartUps have gone up from 4 to 150 and the credibility of India's satellite launching facility has suddenly soared so high that so far from the launching of European

from the launching of American Satellite, India has earned more Jitendra Singh, that today we than 150 Million US Dollars. It is have the confidence and because of PM Modi having conviction to launch the first-ever raised the esteem of the space mission to the Sun.

scientific fraternity, said Dr

POPULAR ESTATE MANAGEMENT LIMITED

CIN - L65910GJ1994PLC023287 Reg.Office : 81, New York Tower Wing- 'X', Opp. Muktidham Derasar, Thaltej Cross Road, S.G. Road, Ahmedabad- 380054. Tele: 079-65415149 - Tele Fax : 079-26858881 e-mail: popularestatemanagement@vahoo.co.in

NOTICE

Notice is hereby given pursuant to Section 91 of the Companies Act. 2013 that the Register of Members and Transfer Books of the Company will be closed from Friday, 22nd day of September, 2023 to Friday, 29th day of September, 2023 (both days inclusive), in connection with 29th Annua General Meeting scheduled to be held on Friday, 29th day of September 2023 through Video Conferencing ("VC") / Other Audio Visual Means "OAVM") and the deemed venue shall be registered office of the company i.e. 81, 8th Floor, "A" wing, New York tower, Opp. Muktidham Derasar Thaltej, S.G. Highway, Ahmedabad-380054, Guiarat.

For, POPULAR ESTATE MANAGEMENT LIMITED

VIKRAM CHHAGANLAL PATEL DIRECTOR, MANAGER AND CFO DIN: 00166707

MEHTA INTEGRATED FINANCE LIMITED

CIN: L65910GJ1985PLC007692

Regd. Off.: 3, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006 Phone No. 91-79-26561000 website: www.mehtaintegratedfinance.com Email : mifl_in@yahoo.com

NOTICE OF 38TH ANNUAL GENERAL MEETING

The 38th Annual General Meeting ("AGM") of the Company will be held on Tuesday, 26th day of September, 2023 at 09:30 A.M., at 003 Law Garden Apartment, Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006

in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under and SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 read with Ministry of Corporate Affairs ("the MCA") vide its circular no. 10/ 2022 dated December 28, 2022 General Circular No. 14/2020 dated 08th April, 2020, General Circular No. 17/2020 dated 13th April 2020 and General Circular No. 20/2020 dated 5th May, 2020 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and SEBI (collectively referred as 'relevant circulars') to transact the business set out in the Notice calling the AGM.

In compliance with the relevant circulars, the Notice of the AGM and the Annual Report for the Financial Year 2022-23 will be sent to all the members in electronic mode whose e-mail addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid document will also be available on the Company's website www.mehtaintegratedfinance.com and on the website of the Stock Exchange

i.e BSE Limited at www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com. Manner of registering/updating e-mail addresses:

a) Members holding shares in physical mode, who have not registered/updated their email addresses with the Company are requested to update/register the same by emailing to Company's Registrar & Share Transfer Agent i.e. Purva Sharegistry (India)

In-Principle approval to set up **21 new Greenfield Airports**

formulated a Greenfield Airports (GFA) Policy, 2008 for development of new country. As per the policy, if develop an airport, they are required to identify a suitable site and get the Pre-feasibility Study conducted for construction of airport and submit a proposal to the Clearance' followed by 'Inapproval. Principle' Government of India has accorded 'In-Principle' approval for setting up of 21 new Greenfield Airports namely, Mopa in Goa, Navi Mumbai, Shirdi and Sindhudurg in Maharashtra, Kalaburagi, Vijayapura, Hassan and Shivamogga in Karnataka, Dabra (Gwalior) in Madhva Pradesh, Kushinagar and Noida (Jewar) in Uttar Pradesh, Dholera and Hirasar in Gujarat, Karaikal in Puducherry, Dagadarthi, Bhogapuram and Orvakal (Kurnool) in Andhra Pradesh, airports) Durgapur in West Bengal, Pakyong in Sikkim, Kannur in Kerala and Hollongi (Itanagar) inception of the UDAN Scheme in Arunachal Pradesh across Greenfield airports viz. airports operationalised/revived Durgapur, Shirdi, Kannur, under RCS is at Annexure. Out

Government of India has Pakyong, Kalaburagi, Orvakal of the above mentioned 21 (Kurnool), Sindhudurg, Greenfield Airports, Kushinagar, Itanagar, Mopa Government of India has and Shivamogga have been Greenfield airports in the operationalised. Besides, Ministry of Civil Aviation has any developer including the also launched Regional State Government desires to Connectivity Scheme (RCS) -UDAN (UdeDeshkaAamNagrik) on 21-10-2016 to stimulate regional air connectivity and making air travel affordable to the masses. An airport which is included in the awarded Central Government for 'Site routes of UDAN and requires upgradation / development for commencement of RCS operations, is developed under "Revival/upgradation of unserved and underserved airports/heliports/water aerodromes" Scheme. Under the scheme, the unserved & underserved airports/airstrips, are identified/awarded all over the country including in the States of Bihar, Jharkhand, Uttar Pradesh, West Bengal and North Eastern States for revival/ development and to operate UDAN flights. Till date, 74 airports (including heliports, water aerodromes & greenfield have been operationalised across the country under UDAN (UdeDeshkaAamNagrik) since Airports. the country. Out of these, 11 in 2016. State wise list of

accorded 'in-principle' approval for setting up 7 greenfield airports as international airports namely Mopa in Goa, Navi Karaikal in Puducherry, Jewar (Noida) in Uttar Pradesh, Dholera and Hirasar in Gujarat and Bhogapuram in Andhra Pradesh. Out of these 7 airports, Airports Authority of India (AAI) has undertaken development of two airports namely Hirasar and Dholera at a total project cost of Rs.1405 crore and Rs.1305 crore respectively from its own resources. Financing of the remaining greenfield airport projects is the responsibility of concerned airport developers. Further, timeline for completion of the airport projects depends upon many factors such as land acquisition, availability of mandatory clearances, financial closure, etc. Ministry of Civil Aviation (MoCA) has taken various steps to attract investments from private investors for development of airport infrastructure in the country including Greenfield

that had shut down. India's major VLSI facility, Semi-Conductor Laboratory (SCL), perished, as a mysterious fire in 1989 halted production until 1997. In 1987, India was just two years behind the latest chip manufacturing Mumbai in Maharashtra, technology. Today, we are 12 generations behind - this is how far behind as a nation on semiconductors," the Minister stated. Shri Rajeev Chandrasekhar also shed light on the job opportunities lost to neighbouring nations that offered incentives to global semiconductor companies. He expressed optimism about India's current investments WESTERN RAILWAY-RAJKOT DIVISION AUTOMATION OF STREET LIGHT AND ELECTRICAL WORK Tender Notice No. DRM/RJT/E-Tender 2023-2024/11 (EL) Dt. 28.08.2023; Address of the Office: Divisional Railway Manager (Electrical), Western Railway Kothi Compound, Rajkot - 360

001; Web site particulars: "www.ireps.gov.in" (1) Tender No.: DRM/RJT/EL/2023-2024/11; (i) Name of Work: Rajkot Division:- Automation o street light at various locations & Electrical work in connection with Replacement of over aged signalling gears at 08 stations in Bhatel - Okha Section. (ii) Approx. Cost: ₹ 56,78,882/-; (iii) EMD Cost: ₹ 1,13,600/-; (iv) Date & time for on line apply: on 29.09.2023 up to 15:00 Hours; (v) Chargeable: 20-3676-03; (vi) Project ID: 15.04.36.23.4.53.004 Like us on: f facebook.com/WesternRly 68 Semiconductor leaders from Satellites, India has earned more than 260 Million Euros and SHANTAI INDUSTRIES LIMITED CIN :L74110GJ1988PLC013255

Reg.Office : 820, Golden Point, Nr. Telephone Exchange, Begumpura, Falsawadi, Ring Road, Surat - 395003. Tel. : 9913425000 E-mail:shantaiindustriesltd@gmail.com Website : www.shantaiindustrieslimited.com

ANNUAL GENERAL MEETING (AGM) NOTICE

Notice is hereby given of the 38th Annual General Meeting of the members of SHANTAI INDUSTRIES LIMITED will be held on Monday, the 25th day of September, 2023 at 820, Golden Point, Nr. Telephone Exchange, Begampura, Falsawadi, Ring Road, Surat-395003 At 04:30 p.m. to transact the business as per Notice of the AGM.

BOOK CLOSURE NOTICE AND E-VOTING

All the shareholders of the company are informed that the member's register of the company will be closed from Tuesday, the 19th day of September, 2023 to Monday. the 25th day of September, 2023(both day inclusive) for the purpose of AGM. The cut-off date for the purpose of e-voting is Monday, 18th September, 2023. All the members are hereby informed that:

Electronic copies of the Notice of AGM have been sent to all the members whose email IDs are registered with the Company/ Depository Participant(s). Physical copies of the Notice of AGM have been sent to all the other members at their registered address. The same is available or Company's website www.shantaiindustrieslimited.com. The dispatch of Notice of AGM have been completed.

Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of 18th September, 2023, may cast their vote electronically on the business set out in the Notice of AGM through electronic voting system of NSDL from a place other than the venue of AGM ("remote e-voting"). All the members are informed that:

- The Businesses as set out in the Notice of AGM may be transacted through voting by electronic means; The remote e-voting shall commence on Friday, 22nd day of September,
- 2023 at 9.00 hrs . shall end on Sunday, 24th day of Septembe The re ote e-votina

Place: Ahmedabad Date: 01/09/2023

SHUBHAM POLYSPIN LIMITED

(CIN: L17120GJ2012PLC069319) Registered Office: Block No. 748, Saket Industrial Estate, Nr. Kaneria Oil Mill, Jetpura- Basantpura Road, Borisana, Tal-Kadi Dist:-Mehsana-382728

NOTICE OF AGM, E-VOTING & BOOK CLOSURE

NOTICE is hereby given that 11th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Saturday, 30th September, 2023 at 2.00 p.m. through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) as per the framework issued by the Ministry of Corporate Affairs (MCA) vide Circular No. 20/ 2020 dated 5th May, 2020 read with Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No. 17/2020 dated 13th April, 2020, Circular No. 02/2021-22 dated 13th Aprile 2021 Circular No. 10221 anuary, 2021, Circular No. 02/2022 dated 5th May, 2022 and Circular No. 10/202 dated 28th December, 2022 (collectively referred to as 'MCA Circular') and SEBI Circular dated May 12, 2020, SEBI Circular dated January 15, 2021, SEBI Circular dated 13th May, 2022 and SEBI Circular dated 5th January, 2023 issued by the Securities and Exchange Board of India (collectively referred as 'SEBI Circulars'). n line with the authorisation given by the MCA/SEBI, Annual Report for th financial year 2022-23 has been sent through E-mail to all the members on their E-mail ids and no physical copies of the Annual Report will be dispatched. Annua Report shall be available on the website of the BSE Limited (www.bseindia.com and also be available on website of the Company (https://shubhampolyspin.com) Please note that Company is convening 11th AGM through VC/OAVM and no physical presence of Members, Directors, Auditors and other eligible person shall be required for the AGM. As per MCA Circulars, the facility to appoint proxy to attend and vote instead of members is not available for this AGM. However, Bodies Corporates are entitled to appoint authorised representative to attend the meeting Corporates are entitled to appoint autobased representative to attend the meeting through VC/OAVM and cast their vote through E-voting during AGM. Members, Directors, Auditors and other eligible persons to whom this Notice is being circulated can attend this AGM through VC/OAVM at least 15 minutes before the schedule time and shall be closed only after expiry of 15 minutes. The attendance of the Members attending the AGM through VC/OAVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. Attendance of the members will be recorded on the CDSI platform at the time when the of the members will be recorded on the CDSL platform at the time when the member log in to attend the AGM through VC/OAVM.

Your Company is pleased to provide Remote E-voting facility through CDSL. The voting rights shall be as per the number of equity shares held by the members as on 23rd September, 2023 (cut-off date). Remote E-voting will commence on 27th September, 2023, Wednesday at 9.00 a.m. IST and ends on 29th September, 2023, Friday at 5.00 p.m. The E-voting module shall be disabled by CDSL for voting hereafter. The Members who have not cast their votes by Remote E-voting car exercise their voting at the AGM. The Company has made arrangements of E otina durina the AGM.

A member may participate in the Annual General Meeting through VC/OAVM even after exercising his rights to vote through Remote E-voting, but shall not be allowed to vote again at the meeting. It may please be noted that the votes giver by any member through Remote E-voting facility shall be treated as final and binding and the shareholder will not be allowed to change it subsequently.

A person, whose name is recorded in the register of members or in the register of peneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of Remote E-voting as well as E-voting during AGM. For detailed instructions pertaining to Remote E-Voling were be voling warms and please refer Notes to the Notice of AGM. A person, who acquires shares and becomes shareholder of the Company after dispatch of Notice and holding shares as on the cut-off date can do Remote E-voting or E-voting during AGM by following the instruction nentioned in the Notes to the Notice of the AGM.

In case of any queries or grievances pertaining to Remote E-Voting procedure, members may refer the Frequently Asked Questions (FAQ's) and E-voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533 or you may also contact concerned employees of CDSL on 022-23058543/ 23058542 (between 10.00 a.m to 6.30 p.m. on Monday – Friday).

Notice is also hereby given that pursuant to Regulation 42 of the SEBI (LODR) Regulations, 2015 and Section 91 of the Companies Act, 2013 read with applicable Rules, the Register of Members and Share Transfer Books of the Company will ain closed from Saturday, 23rd September, 2023 to Saturday, 30th September, 2023 (both days inclusive) for the purpose of AGM.

By Order of the Board For SHUBHAM POLYSPIN LIMITED ANKIT ANIL SOMANI (DIN: 05211800) Place: Borisana CHAIRPERSON AND MANAGING DIRECTOR Date: 1st September, 2023

MEHTA SECURITIES LIMITED

CIN: L67120GJ1994PLC022740

Regd. Off.: 2, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006 Phone No. 91-79-26561000 website: www.mehtasecurities.com Email : mehtasec@gmail.com

NOTICE OF 29TH ANNUAL GENERAL MEETING

The 29th Annual General Meeting ("AGM") of the Company will be held on Tuesday, 26th day of September, 2023 at 11:30 A.M., at 002 Law Garden Apartment, Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006

oIn compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under and SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 read with Ministry of Corporate Affairs ("the MCA") vide its circular no. 10/2022 dated December 28, 2022 and General Circular No. 14/2020 dated 08th April. 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 and General Circular No. 20/2020 dated 5th May, 2020 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and SEBI (collectively referred as 'relevant circulars') to transact the business set out in the Notice calling the AGM

• In compliance with the relevant circulars, the Notice of the AGM and the Annual Report for the Financial Year 2022-23 will be sent to all the members in electronic mode whose e-mail addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid document will also be available on the Company's website www.mehtasecurities.com and on the website of the Stock Exchange i.e BSE Limited at www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Manner of registering/updating e-mail addresses:

a)Members holding shares in physical mode, who have not registered/ updated their email addresses with the Company are requested to update/register the same by emailing to Company's Registrar & Share Transfer Agent i.e. Purva Sharegistry (India) Pvt. Ltd at support@purvashare.com or at company's mail address i.e. mehtasec@vahoo.co.in.

b)Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses with the Depository Participants are requested to register/update their e-mail addresses with the Depository Participants with whom they maintain their demat accounts.

Manner of casting vote(s) through e-voting:

The Company is providing remote e-voting facility ("remote e- voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Detailed procedure for remote e- voting is provided in the Notice of AGM. Remote E-voting period starts at Friday, 22nd September, 2023 (09:00 A.M. IST) and ends at Monday, 25th September, 2023 (05:00 P.M. IST). The remote e-voting module will be disabled by National Securities Depository Limited (NSDL) for voting thereafter.

Book Closure Date & Cut-off Date:

a) The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, 20th September, 2023 to Tuesday, 26th September, 2023 (both days inclusive) for the purpose of AGM recommended by the Board of Directors for the financial year ended on 31st March, 2023

b)The cut-off date for determining the eligibility to vote by remote evoting for the AGM is Tuesday, 19th September, 2023.

· Members are requested to carefully read the Notes set out in the Notice of the AGM and manner of casting vote through remote e- voting. For Mehta Securities Limited

Sd/

Mahesh Motivaras icer

Date: 2nd september 2023	Company Secretary & Compliance Officer
Place: Ahmedabad	ACS-63815

- 2023 at 17:00 hrs.;
- The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is 18th September, 2023.
- Any person, who acquires shares of the company and become member of the company after the dispatch of the notice of AGM and holding shares as of the cut-off date i.e.18th September, 2023 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in However, if a person is already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting vote. A person who is not a Member as on the Cut-Off Date should treat the Notice of the AGM for information purposes only;
- Members may note that: (a) the remote e-voting module shall be vi. disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shal not be allowed to change it subsequently; (b) the facility for voting through polling paper shall be made available at the AGM; (c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and (d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM as instruction mention in Notice of AGM.
- In case of any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evoting.nsdl.com under help section or or call on toll free no.: 1800-1020-990 or send a request to (Ms. Sarita Mote) at evoting@nsdl.co.in

By order of the Board For Shantai Industries Limited

Place: Surat Komal Agarwal Company Secretary & Compliance Officer Date: 02/09/2023

homefirst



- b) Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses with the Depository Participants are requested to register/update their e-mail addresses with the Depository Participants with whom they maintain their demat accounts.
- Manner of casting vote(s) through e-voting:

The Company is providing remote e-voting facility ("remote e- voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Detailed procedure for remote e- voting is provided in the Notice of AGM. Remote E-voting period starts at Friday, 22nd September, 2023 (09:00 A.M. IST) and ends at Monday, 25th September, 2023 (05:00 P.M. IST). The remote e-voting module will be disabled by National Securities Depository Limited (NSDL) for voting thereafter.

- Book Closure Date & Cut-off Date:
- a) The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, 20th September, 2023 to Tuesday, 26th September, 2023 (both days inclusive) for the purpose of AGM, recommended by the Board of Directors for the financial year ended on 31st March, 2023.
- b) The cut-off date for determining the eligibility to vote by remote e-voting/e-voting at the AGM is Tuesday, 19th September, 2023.
- Members are requested to carefully read the Notes set out in the Notice of the AGM and manner of casting vote through remote e- voting.

For Mehta Integrated Finance Limited Sd/Kamleshbhai P. Patel Date: 2nd september 2023 Company Secretary & Compliance Officer Place: Ahmedabad ACS:10772

Home First Finance Company India Limited CIN: L65990MH2010PLC240703

Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com

POSSESSION NOTICE

Sd/

REF: POSSESSION NOTICE UNDER SUB-RULE (1) OF RULE 8 OF THE SECURITY INTEREST (ENFORECEMENT) RULES, 2002

WHEREAS the undersigned being the Authorized Officer of HOME FIRST FINANCE COMPANY INDIA LIMITED, pursuant to demand notice issued on its respective dates as given below, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 calling upon you/Borrowers, the under named to pay outstanding dues as within 60 days from the date of receipt of respective notices. You/Borrowers all, however, have failed to pay the said outstanding dues within stipulated time, hence HOME FIRST FINANCE COMPANY INDIA LIMITED are in exercise and having right as conferred under the provision of sub section (4) of section 13 of SARFAESI ACT, 2002 read with rules thereunder, taken POSSESSION of the secured assets as mentioned herein below:

S. No	Name of Borrowers/ Co- Borrowers/ Guarantors	Description of Mortgaged Property	Date of Demand Notice	Total O/s as on date of Demand Notice (in INR)	Date of possession
1.	Ladawa Rameshkumar, Ladva Jayshreeben	Flat-206,Block- N, Dev Nandan Sankalp City,opp.108 institute ,hanspura road,nr. 200 ft. ring road,naroda Ahmedabad 382330	20-06-2023	9,37,531	28-08-2023
2.	Muraribhai Soni	Flat No. 504, Building C, Kushal Awaas, Survey No 1448, FP No 73, B/h Ayodhya Appartment, Vatva, Ahmedabad, 382445	06-05-2023	8,79,682	28-08-2023
3.	Dilip Kalusingh Rajput, Yashoda Dilipbhai Rajput	Row house- 95, Uma Vihar, Block no 31, registration no 25, dastan, palsana, surat Surat 394315	20-06-2023	10,25,268	01-09-2023
	property described herein belo	y the amount, notice is hereby given to the borrower / Guarantor and the public in genera w in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read w			
and	any dealing with the said Pro	and the PUBLIC IN GENERAL are hereby cautioned not to deal with the above referred operties/Secured Assets shall be subject to charge of HOME FIRST FINANCE COMPA ecured Assets which is payable with the further interest thereon until payment in full.			
The	borrower's attention is invite	d to the provisions of subsection (8) of Section 13 of the Act, in respect of time available	to redeem the	e secured asset.	
	e: Gujarat			Auth	orised Officer

Date: 03-09-2023

તંત્રીશ્રીની કલમે કોરોના પર આ અહેવાલે ચીનનું રહસ્ય ખોલ્યું

વિશ્વના ઘણા દેશોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીનથી જ ફેલાયો છે. પરંતુ કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. માત્ર આક્ષેપો થયા છે. જો કે, ચીને કોરોના કેસ અને આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો વિશ્વની સામે મૂક્યો નથી. હવે એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ચીને અચાનક પ્રતિબંધ હટાવ્યા બાદ બે મહિનામાં કોવિડ-૧૯થી ૧૮ લાખથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના સિએટલમાં ફ્રેડ હચિન્સન કેન્સર સેન્ટરે અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ ચીનની કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા અને ઇન્ટરનેટ સર્ચ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં મૃત્યુદરના ડેટાના નમૂના લેવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ વચ્ચે ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. મૃત્યુનો આંકડો ૧.૮૭ મિલિયન છે. જો કે તેમાં તિબેટમાં મૃત્યુનો આંકડો સામેલ નથી. ચીને ગયા ડિસેમ્બરમાં ત્રણ વર્ષથી લાગુ કરવામાં આવેલી ઝીરો કોવિડ નીતિને અચાનક સમાપ્ત કરી દીધી હતી. આ નીતિ હેઠળ સામૂહિક પરીક્ષણ અને લોકડાઉન સહિતના ઘણા કડક નિયંત્રણો અમલમાં હતા. ઝીરો કોવિડ પોલિસી નાબદ થતાંની સાથે જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના મૃત્યુમાં ભારે વધારો થયો હતો. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સરકાર દ્વારા મોટાભાગે કેસ ઓછા નોંધવામાં આવ્યા હતા. અભ્યાસમાં, સંશોધકોએ પ્રસિદ્ધ થયેલા મૃત્યુના આંકડાકીય વિશ્લેષણનો ઉપયોગ કર્યો હતો અને લોકપ્રિય ચાઈનીઝ ઈન્ટરનેટ સર્ચ એન્જિન બાઈડ પરના સંશોધનમાંથી ડેટાનો ઉપયોગ કર્યો હતો. સંશોધકો કહે છે કે ચીનમાં શુન્ય-કોવિડ નીતિને દૂર કરવાથી સંબંધિત વધુ મૃત્યુનો તેમનો અભ્યાસ પ્રયોગમૂલક રીતે મેળવેલા બેન્ચમાર્ક અંદાજને સેટ કરે છે. તે જ સમયે આ અભ્યાસના પ્રકાશન પછી, ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે હાલમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ભારતની સફળતાથી ચીન છે નારાજ?

ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપૂર્વક શકે. ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ભારતના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતર્યા કે તરત જ વિશ્વભરના અખબારોએ તેને પ્રાધાન્યતા પર પ્રકાશિત કરી અને ભારતના પ્રમાણમાં સસ્તા અવકાશ કાર્યક્રમને લોખંડી ગણાવ્યો. પરંતુ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર ગણાતા અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ સમાચાર લાંબા સમય પછી ૨૪ ઓગસ્ટે મોડી સાંજે પ્રકાશિત કર્યા અને ત્યારબાદ ભારતના અંતરિક્ષ કાર્યક્રમની ચીન સાથે તુલના કરી અને તેની ખામીઓ નીકાળી છે.

ગ્લોબલ ટાઈમ્સે ચીનની ટેક્નોલોજીની ભારત સાથે સરખામણી કરતા કહ્યું કે ચીન વિવિધ પાસાઓમાં ભારત કરતા વધુ આગળ છે. પેપરમાં બેઈજિંગ સ્થિત વરિષ્ઠ અવકાશ નિષ્ણાત પેંગ ઝિહાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ૨૦૧૦માં ચાંગે ઈ-રના પ્રક્ષેપણથી, ચીન ઓર્બિટર અને લેન્ડરને સીધા પૃથ્વી-ચંદ્ર ટ્રાન્સફર ઓર્બિટમાં મોકલવામાં સક્ષમ છે. ભારત પાસે આ ટેક્નોલોજી નથી કારણ કે તેના લોન્ચ વાહનોની ક્ષમતા મર્યાદિત છે. ચીનની ટેકનોલોજી અઘતન છે જેના કારણે સમય અને ઈંધણની બચત થાય છે. ચીન જે ઈંધણ વાપરે છે તે ઘણું એડવાન્સ છે. ચીનના અખબારે ભારતને હલકી કક્ષાનું ચિત્રિત કરવાનો પ્રયાસ કરતાં એક નિષ્ણાતને ટાંકીને કહ્યું કે, 'ચીનનું રોવર વિશાળ છે, તેનું વજન ૧૪૦ કિલો છે, જ્યારે ભારતના રોવર પ્રજ્ઞાનનું વજન માત્ર ૨૬ કિલો છે. ભારતનું પ્રજ્ઞાન ચંદ્રની રાત્રિનો સામનો કરી શકતું નથી અને ચંદ્ર પર માત્ર એક દિવસનું જીવનકાળ ધરાવે છે (એક ચંદ્ર દિવસ ૧૪ પૃથ્વી દિવસ બરાબર છે.) તેનાથી વિપરોત, ચીનનું

નવીદિલ્હી, ભારત ચંદ્રની ર્ટે-ર રોવર ચંદ્રની સપાટી પર લાંબા સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર સમય સુધી કામ કરવાનો રેકોર્ડ ધરાવે દેશોની હરોળમાં જોડાઈ ગયું છે. છે કારણ કે તે પરમાણ શક્તિથી સજ બુધવારે, ભારતના ચંદ્રયાન-૩ એ છે, જેથી તે લાંબા સમય સુધી કામ કરી

દેશનાં ૩૧ ટકા ભાગોમાં ઓછા વરસાદની હાલત

મોટાભાગનાં ક્ષેત્રોમાં જુન-જુલાઈમાં બે સપ્તાહ અત્યંત મહત્વના-નિર્ણાયક નોંધપાત્ર કે સારો વરસાદ વરસ્યા બની શકે છે. બે સપ્તાહમાં વર્તમાન ચેરાપુંજીની છે.મેઘાલયનાં ચેરાપુંજી મેડીટેશનનાં પાટનગર ગણાતા બાદ એકાન મહિનાથી વરીસાદી બ્રેક માહોલમાં કોઈ બદલાવ ન થવાના તથા મૌસીનરામમાં સૌથી વધુ ઋષિકેશમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં છે અને તેના કારણે દેશના ૩૧ ટકા સંજોગોમાં પાણીની ડીમાંડ વધશે.૧ ભાગો 'શુષ્ક'ની શ્રેણીમાં આવી ગયા જુનથી ૨૩ ઓગસ્ટ સુધીના ઈન્ડેકસ છે. કૃષ્િ ઉપજ-ઉત્પાદન તથા રીપોર્ટને ધ્યાને લેવામાં આવે તો પશ જમીનના ભેજને તેની વ્યાપક અસર કેટલાંક રાજયોનાં અનેક ભાગો લાલ થવાની આશંકા છે.ભારતીય નિશાનીમાં જ છે. અર્થાત વરસાદી હવામાન વિભાગનાં ૨૭ જુલાઈથી ખાદ્ય ધરાવે છે. તેઓએ કહ્યું કે દેશમાં ૨૩ ઓગસ્ટનાં સ્ટાંડર્ડાઈઝખ વર્તમાન વરસાદી બ્રેકમાં ૨૦૦૨ નું ત્રિસીએટેશન ઈન્ડેકસમાં આ ખુલાસો પુનરાવર્તન થઈ રહ્યાનું માલુમ પડી થયો છે. હવામાન વિભાગે દુષ્કાળ ૨હ્યું છે. ૨૦૦૩ નાં જુલાઈમાં શબ્દ પડતો મૂકી દીધો છે અને નબળા મેઘરાજાએ સળંગ ૨૬ દિવસે બ્રેક ચોમાસા માટે ઓછા વરસાદનો શબ્દ લીધો હતો અને વરસાદ વરસ્યો પ્રયોગ કરવામાં આવે છે.દેશમાં છેલ્લા હતો.ચોમાસાની વર્તમાન હાલતથી એક માસથી ચોમાસું નબળુ જ કૃષિક્ષેત્રમાં નેગેટીવ અસર થવાની ગણવામાં આવ્યુ છે. હવામાન ભીતિ છે.વરસાદ અને સીંચાઈનાં વિભાગનાં રીપોર્ટ પ્રમાશે ૩૧ ટકા પર્યાપ્ત પાણી વિના કૃષિ ઉત્પાદનને ભાગોમાં વરસાદની ખાધ છે અને તે ફટકો પડે અને ખેડુતોને આર્થિક પૈકી ૯ ટકા ભાગોમાં ઘણો ઓછો નુકશાન થઈ શકે છે. તાપમાન પણ વરસાદ છે. ૪ ટકા ત્યંત શખ્ક નોર્મલથી ઉંચે જઈ રહ્યું હોવાના કારણે વાતાવરણનો સામનો કરી રહ્યા છે. તળાવો તથા ભુગર્ભ જળ સપાટીને પણ અસર કારક છે. તેઓએ કહ્યું કે આવા ભાગોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્રુચિમી દરીયાકાંઠા તથા પૂર્વ હવે સપ્ટેમ્બરમાં વરસાદી ખાઘ ભારતના ક્ષેત્રો આવી જાય છે. સરભર થઈ શકે છે કે કેમ તે જોવાન આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ભારતનાં રહે છે. ભારતીય ચોમાસા તથા અલ-૪૭ ટકા ભાગોમાં ઘણા અંશે શુષ્ક નીનો વચ્ચેનું કનેકશન જાણીતું છે. વાતાવરણ રહ્યું ચે. આ પ્રકારનાં અલનીનોની વધતી તાકાત સાથે માહોલથી જર્મોનનાં ભેજને અસર ઉદભવી રહ્યું હોવાથી ઓગસ્ટનાં થાય છે.ખેતીપાકનાં વિકાસ તથા વરસાદી બ્રેકમાં તે કારણરૂપ હોવાનું ઉત્પાદન પ્રભાવીત થાય છે. હવામાન મનાય જ રહ્યું છે. આ સંજોગોમાં વિભાગના વિજ્ઞાની રજીબ પાણી મોરચે સંકટની સ્થિતિ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે એકાદ મહિનાથી સર્જાવાનાં સંજોગોમાં આગોતરા વરસાદી બ્રેકને કારણે કેટલાંક ક્ષેત્રોમાં આયો જનો ની તૈયારી કરવી

પડશે.ભારતનાં જ નહિં સમગ્ર

ભારતના મોરચે દબાણ સર્જાઈ શકે છે. હવેના વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતાં છે ત્યાં સુધી આ સ્થાન ઉતરાખંડનાં સ્થળ-શહેર તરીકેની ઓળખ ઋષિકેશે મેળવી લીધુ છે. યોગ અને વરસાદ થતો રહ્યો છે. પરંતુ ચાલું સળંગ વરસાદ થયો છે અને સૌથી વધુ વર્ષનાં ઓગસ્ટ મહિનાને લાગેવળગે પાણી વરસ્ય છે.

MEHTA SECURITIES LIMITED

CIN: L67120GJ1994PLC022740 Regd. Off.: 2, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006 Phone No. 91-79-26561000 website: www.mehtasecurities.com Email : mehtasec@gmail.com

NOTICE OF 29TH ANNUAL GENERAL MEETING

The 29th Annual General Meeting ("AGM") of the Company will be held on Tuesday, 26th day of September, 2023 at 11:30 A.M., at 002 Law Garden Apartment, Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006

oIn compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under and SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 read with Ministry of Corporate Affairs ("the MCA") vide its circular no. 10/2022 dated December 28, 2022 and General Circular No. 14/2020 dated 08th April. 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 and General Circular No. 20/2020 dated 5th May, 2020 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and SEBI (collectively referred as 'relevant circulars') to transact the business set out in the Notice calling the AGM.

 In compliance with the relevant circulars, the Notice of the AGM and the Annual Report for the Financial Year 2022-23 will be sent to all the members in electronic mode whose e-mail addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid document will also be available on the Company's website www.mehtasecurities.com and on the website of the Stock Exchange i.e BSE Limited at www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Manner of registering/updating e-mail addresses:

a)Members holding shares in physical mode, who have not registered/ updated their email addresses with the Company are requested to update/register the same by emailing to Company's Registrar & Share Transfer Agent i.e. Purva Sharegistry (India) Pvt. Ltd at support@purvashare.com or at company's mail address i.e. mehtasec@vahoo.co.in.

b)Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses with the Depository Participants are requested to register/update their e-mail addresses with the Depository Participants with whom they maintain their demat accounts. Manner of casting vote(s) through e-voting:

The Company is providing remote e-voting facility ("remote e- voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Detailed procedure for remote e- voting is provided in the Notice of AGM. Remote E-voting period starts at Friday, 22nd September, 2023 (09:00 A.M. IST) and ends at Monday, 25th September, 2023 (05:00 P.M. IST). The remote e-voting module will be disabled by National Securities Depository Limited (NSDL) for voting thereafter. Book Closure Date & Cut-off Date:

a)The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, 20th September, 2023 to Tuesday, 26th September, 2023 (both days inclusive) for the purpose of AGM, recommended by the Board of Directors for the financial year ended on 31st March, 2023.

b)The cut-off date for determining the eligibility to vote by remote evoting for the AGM is Tuesday, 19th September, 2023.

 Members are requested to carefully read the Notes set out in the Notice of the AGM and manner of casting vote through remote e- voting. For Mehta Securities Limited

Mahesh Motivaras

ACS-63815

Date: 2nd september 2023 Company Secretary & Compliance Officer Place: Ahmedabad

MEHTA INTEGRATED FINANCE LIMITED CIN: L65910GJ1985PLC007692

POPULAR ESTATE MANAGEMENT LIMITED

CIN - L65910GJ1994PLC023287 Reg.Office : 81, New York Tower Wing- 'A', Opp. Muktidham Derasar, Thaltej Cross Road, S.G. Road, Ahmedabad- 380054. Tele: 079-65415149 - Tele Fax : 079-26858881 e-mail: popularestatemanagement@yahoo.co.in

NOTICE

Notice is hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Members and Transfer Books of the Company will b closed from Friday, 22nd day of September, 2023 to Friday, 29th day of September, 2023 (both days inclusive), in connection with 29th Annua General Meeting scheduled to be held on Friday, 29th day of September 2023 through Video Conferencing ("VC") / Other Audio Visual Mean ("OAVM") and the deemed venue shall be registered office of the company i.e. 81, 8th Floor, "A" wing, New York tower, Opp. Muktidham Derasar Thaltej, S.G. Highway, Ahmedabad-380054, Gujarat.

For, POPULAR ESTATE MANAGEMENT LIMITED

2

VIKRAM CHHAGANLAL PATEL DIRECTOR, MANAGER AND CFO DIN: 00166707 Place: Ahmedabad Date: 01/09/2023

શુભમ પોલિસ્પીન લિમિટેડ

સીઆઈએન:L17120GJ2012PLC069319

રજીસ્ટર્ડ ઓફિસ ઃ બ્લોક નં. ૭૪૮, સાકેત ઈન્ડ્સ્ટ્રીયલ એસ્ટેટ, કનેરીયા ઓઈલ મિલ પાસે, જેતપુરા-બસંતપુરા રોડ, બોરીસણા, તા. કડી, જી. મહેસાણા-૩૮૨૭૨૮

એજીએમ, ઇ-વોટીંગ અને બુક ક્લોઝરની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ૫મી મે, ૨૦૨૦ પરિપત્ર નં. ૧૪/ ૨૦૨૦ સાથે વાંચતા તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦ પરિપત્ર નં.૧૭/૨૦૨૦, તારીખ ૧૩મી એપ્રિલ ૨૦૨૦ પરિષત્ર નં.૦૨/૨૦૨૧-૨૨ તારીખના. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ ની તારીખના પરિષત્ર ૦૨/ ૨૦૨૨ અને તા.૫મી મે ૨૦૨૨ અને પરિષત્ર નં. ૧૦/૨૦૨૨ તા.૨૮મી ડીસેમ્બર ૨૦૨૨ (સામુહિકરૂપે એમસીએ પરિપત્રો તરીકે સંદર્ભિત) અને સેબી દ્વારા આપવામાં આવેલા ૧૨મી મે ૨૦૨૦.સેબી પરિપત્ર તા.૧૫મી જાન્યુઆરી ,૨૦૨૧,સેબી પરિપત્ર, ૧૩મી મે, ૨૦૨૨ ની તારીખના સેબી પરિપત્ર અને ૫મી જાન્યઆરી. ૨૦૨૩ની તારીખના સેબી પરિપત્ર (સામહિકરૂપે સેબી પરિપત્રો તરીકે સંદર્ભિત) થી આપવામાં આવેલા માળખા મુજબ કંપનીના સભ્યોની ૧૧મી વાર્ષિક જનરલ મીટીંગ (એજીએમ) વીડિયો કોન્ફરન્સીંગ (વીસી) / અન્ય દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો (ઓએવીએમ) મારફતે મારફતે શનિવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૨.૦૦ કલાકે યોજાશે.

એમસીએ/સેબી દ્વારા આપવામાં આવેલી અધિકૃતતાને અનુરૂપ, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેનો વાર્ષિક રિપોર્ટ તમામ સભ્યોને તેમના ઇ-મેઈલ આઈડીઝ ઉપર મોકલી આપવામાં આવ્યો છે અને વાર્ષિક રિપોર્ટની ભૌતિક નકલ મોકલવામાં આવશે નહીં. વાર્ષિક રિપોર્ટ બીએસઇ લિમિટેડની વેબસાઈટ (www.bseindia.com) ઉપર ઉપલબ્ધ રહેશે અને કંપનીની વેબસાઈટ (https:// shubhampolyspin.com) ઉપર પણ ઉપલબ્ધ રહેશે.

કૃપા કરી નોંધ લેશો કે કપંની ૧૧મી એજીએમ વીસી/ઓએવીએમ મારફતે બોલાવવામાં આવી રહી છે અને સભ્યો. ડાયરેક્ટરો. ઓડિટરો અને અન્ય પાત્ર વ્યક્તિઓની એજીએમ માટે ભૌતિક ઉપસ્થિતિની આવશ્યકતા નથી. એમસીએ પરિપત્રો મુજબ, આ એજીએમ માં ઉપસ્થિતિ અને મતદાન માટે સભ્યો દ્વારા પ્રોકસીની ની નીમણું કતાની સુવિધા ઉપલબ્ધ નથી. જોકે, કોર્પોરેટ્સ સંસ્થાઓને વીસી/ઓએવીએમ મારફતે મીટિંગમાં હાજરી આપવા અને એજીએમ દરમિયાન ઇ-વોટીંગ માટે તેમના મત આપવા માટે અધિકૃત પ્રતિનિધિની નિમણૂક કરવાનો અધિકાર છે. સભ્યો, ડાયરેક્ટરો, ઓડિટરો અને અન્ય પાત્ર વ્યક્તિઓ કે જેમને આ સૂચના પ્રસારિત કરવામાં આવી રહી છે તેઓ આ એજીએમમાં વીસી/ઓએવીએમ મારફતે નિર્ધારિત સમયના ઓછામાં ઓછા ૧૫ મિનિટ પહેલાં હાજરી આપી શકે છે અને ૧૫ મિનિટની સમાપ્તિ પછી જ બંધ થશે. કંપનીઝ ધારા, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ વીસી/ઓએવીએમ મારફતે એજીએમમાં ઉપસ્થિત સભ્યોની કોરમના હેતુસર ગણતરી કરવામાં આવશે. સભ્ય દ્વારા વીસી/ઓએવીએમ મારફતે એજીએમમાં ઉપસ્થિતિ માટે લૉગ ઇન કરતાં સમયે સભ્યોની ઉપસ્થિતિની સીડીએસએલ પ્લેટફોર્મ પર નોંધવામાં આવશે.

આપની કંપનીએ સીડીએસએલ મારફતે રિમોટ ઇ-વોટીંગની સુવિધાની ઉપબ્ધ કરાવી છે. મત આપવાના અધિકારો ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (કટ-ઓફ તારીખ) ના રોજ મુજબ સભ્યો દ્વારા ધારણ કરાયેલા શેરોની સંખ્યા પ્રમાણે રહેશે. રિમોટ ઇ-વોટીંગ ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ને બુધવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ભારતીય સમયે શરૂ થશે અને ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ને શુક્રવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે ભારતીય સમયે સમાપ્ત થશે. ત્યારબાદ મતદાન માટેનું ઇ-વોટીંગ મોડ્યુલ સીડીએસએલ દ્વારા અક્ષમ કરવામાં આવશે. સભ્યો જેમણે રિમોટ ઇ-વોટીંગ દ્વારા તેમના મત ન આપ્યા હોય તેઓ એજીએમમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કંપનીએ એજીએમ દરમિયાન ઇ-વોટીંગની વ્યવસ્થાઓ કરી રાખી છે. સભ્ય રિમોટ ઇ-વોટીંગ મારફતે તેમના મત આપવાના અધિકારનો ઉપયોગ કરી લીધા પછી પણ વીસી/ઓએવીએમ મારફતે વાર્ષિક જનરલ મીટીંગમાં ભાગ લઈ શકશે, પરંતુ તેમને મીટીંગમાં ફરીથી મત આપવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કૃપા કરીને નોંધ લેશો કે કોઈપણ સભ્ય દ્વારા રિમોટ ઇ-વોટીંગ સુવિધા મારફતે અપાયેલ મત આખરી અને બંધનકર્તા રહેશે અને શેરહોલ્ડરને તેને પાછળથી બદલવાની પરવાનગી આપવામાં આવશે નહીં

જે વ્યક્તિનં નામ સભ્યોના રજીસ્ટરમાં અથવા ડિપોઝીટરીઝ દારા જળવાયેલા લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલું છે માત્ર તેઓ જ રિમોટ ઇ-વોટીંગની સુવિધા મેળવવા તેમજ એજીએમ દરમિયાન ઇ-વોટીંગ માટે હકદાર રહેશે. રિમોટ ઇ-વોટીંગને લગતી વિગતવાર સૂચનાઓ માટે, સભ્યો કૃપા કરી એજીએમની નોટીસનો સંદર્ભ લેશો. જે વ્યક્તિઓએ નોટીસની રવાનગી પછી શેરો હસ્તગત કર્યા છે અને કંપનીના શેરહોલ્ડર બન્યા છે અને કટ-ઓફ તારીખ મુજબ શેરો ધરાવે છે, તેઓ એજીએમની નોટીસની નોંધોમાં જણાવેલી સૂચનાઓનું અનુસરણ કરીને રિમોટ ઇ-વોટીંગ અથવા એજીએમ દરમિયાન ઇ-વોટીંગ કરી શકશે.

રિમોટ ઇ-વોટીંગ પ્રક્રિયાને લગતી કોઈપણ પૂછપરછ અથવા ફરિયાદોના મામલામાં, સભ્યો www.evotingindia.com ખાતે હેલ્પ સેંક્શન હેઠળ ઉપલબ્ધ ફ્રિક્વન્ટલી આસ્કડ કવેશન્સ (એફએક્યુઝ) અને ઇ-વોટીંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકે છે અથવા helpdesk.evotina @cdslindia.com ને ઇમેઈલ લખી શકે છે અથવા ૧૮૦૦૨૨૫૫૩૩ ને ફોન કરી શકે છે અથવા તમે સીડીએસએલના સંબંધિત કર્મચારીઓનો (સોમવાર થી શુક્રવાર સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૩૦ કલાક દરમિયાન) ૦૨૨-૨૩૦૫૮૫૪૩/૨૩૦૫૮૫૪૨ ઉપર પણ સંપર્ક કરી શકો છો.

હાલત ખરાબ બની રહી છે પાણી દિશા રિસોર્સિસ લિમિટેડ

CIN:L74110GJ1995PLC024869 રજી.ઓફિસ : ૩, રાજેશ એપાર્ટમેન્ટ, અજંટા કોમ.એસ્ટેટ પાછળ, ઓફ આશ્રમ રોડ,અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન : ૦૭૯ -૨૭૫૪-૦૭૯૦, ૦૭૯-૨૭૫૪૩૦૬૦ ઈ-મેલ :disharesourceslimited@gmail.com વેબસાઇટ : www.disharesourcesltd.com

૨૮મી સામાન્ય સભાની સૂચના (ઇ-વોટિંગ અને બુક ક્લોઝરની માહિતી)

આથી સચના આપવામાં આવે છે : ૧. કંપનીની ૨૮મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ગુરૂવાર, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ બપોરે ૧૨-૦૦ ક્લાકે કંપનીની ૩, રાજેશ એપાર્ટમેન્ટ, અજંટા કોમ.એસ્ટેટ પાછળ, ઓફ આશ્રમ રોડ,અમદાવાદ-૩૮૦૦૧૪ ખાતે સ્થિત રજી.ઓફિસમાં યોજાશે.

૨. ૧૨મી ઓગષ્ટ, ૨૦૨૩ની એજીએમની નોટિસની ઇલેકટ્રોનિક નકલો, એજીએમમાં પ્રસ્તાવિત ઠરાવો પર કામ કરવા માટે, નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩નો વાર્ષિક અહેવાલ સાથે તે સભ્યોને મોકલી આપવામાં આવેલ છે જે તા.૨૫મી ઓગષ્ટ,૨૦૨૩ના રોજ શેર ધરાવે છે અને જેમના ઇ-મેલ આઈડી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ સાથે નોધાયેલા છે. નોટિસ તથા ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેબસાઇટ www.disharesourcesltd.com પર ઉપલબ્ધ છે. તથા સેન્ટલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા)લિમિટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ www.evotingindia.com પર તથા બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (બીએસઈ)ની વેબસાઈટ www.bseindia.com

પર પણ ઉપલબ્ધ છે. એજીએમની નોટિસ અને વાર્ષિક અહેવાલ જેમને મંજૂરી આપવામાં આવી છે તે અન્ય તમામ સભ્યોને તેમના નોંધાયેલા સરનામા ઉપર મોકલી આપવામાં આવેલ છે. એજીએમ નોટિસ મોકલવાની પ્રક્રિયા ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પૂર્ણ થઈ ગઈ છે.

૩. કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન)નિયમો,૨૦૧૪ના નિયમ ૨૦ સાથે વાંચેલા, કંપની એક્ટ,૨૦૧૩ કલમ ૧૦૮ની જોગવાઈઓને અનુસરીને, ૨૮મી વાર્ષિક સામાન્ય સભામાં પ્રસ્તાવિત ઠરાવો પર મત આપવા અને વ્યવસાયના વ્યવહાર કરવા માટે કંપની તેના સભ્યોને તેમના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે રિમોટ ઇ-વોટિંગ સુવિધા પુરી પાડીને કંપની ખુશ છે.

૪. કટ-ઓફ તારીખે એટલેકે ૨૧-૯-૨૦૨૩ના રોજ ભૌતિક સ્વરૂપે અથવા ડીમેટ સ્વરૂપે શેર ધરાવતા સભ્યોનું નામ સભ્યોના રજીસ્ટરમાં દેખાતા હોય તેવા સભ્યોને જ રિમોટ ઇ-વોટિંગ તેમજ ભૌતિક મતપત્ર દ્વારા મતદાનની સુવિધા મેળવવા માટે હકદાર રહેશે. સભ્યો એજીએમના સ્થળ સિવાયના સ્થળેથી (રિમોટ ઇ-વોટિંગ) સેન્ટલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા)લિમિટેડ (સીડીએસએલ)ની ઇલેકટોનિક વોટિંગ સિસ્ટમ દ્વારા એજીએમની સચનામાં દર્શાવ્યા મજબ વેપારના ઠરાવો પર મહ ઇલેકટોનિક રીતે આપી શકે છે.

૧) એજીએમની સૂચનામાં દર્શાવ્યા મુજબનો વ્યવસાયના વ્યવહાર ઇલેકટ્રોનિક માધ્યમથી મતદાન કરી શકાય છે.

ર) રિમોટ ઇ-વોટિંગ સોમવાર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ (સવારે ૯-૦૦ ક્લાકે) શરૂ થશે.

૩) રિમોટ ઇ-વોટિંગ બુધવાર, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ (સાંજે ૫-૦૦ ક્લાકે) સમાપ્ત થશે ૪) ઇલેકટોનિક માધ્યમથી અથવા એજીએમમાં મત આપવાની પાત્રતા નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ (૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૩) છે ૫) ઇલેકટ્રોનિક માધ્યમથી ઇ-વોટિંગને ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૫-૦૦ ક્લાક (આઈએસટી) બાદ મંજૂરી આપવામાં આવશે નહીં. ∉) જે કોઇ વ્યક્તિ કંપનીના શેર મેળવે છે. અને એજીએમની નોટિસ મોકલ્યા બાદ કટ-ઓફ તારીખે એટલેકે ૨૫મી સપ્ટેમ્બર. ૨૦૨૩ના રોજ શેર ધારણ કરે છે અને કંપનીના સભ્ય બને છે તેઓ helpdesk.evoting@cdslindia.com//ahmedabad@linkintime.co.in.પર વિનંતી મોકલીને લોગઇન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે ૭) સભ્યો નોંધ કરી શકે છે કે એ) સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા)લિમિટેડ (સીડીએસએલ) દ્વારા રિમોટ ઇ-વોટિંગ મોડ્યુલ ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૫-૦૦ કલાક (આઈએસટી) બાદ અક્ષમ કરવામાં આવશે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપ્યા બાદ તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બી) બેલેટ/ પોલ દ્વારા મતદાન કરવાની સુવિધા એજીએમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સી) જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઇ-વોટિંગ દ્વારા તેમનો મત આપેલ છે તેઓ પણ એજીએમમાં હાજરી આપી શકશે પરંતુ તેઓ ફરીથી તેમને મત આપવા હકદાર નથી. અને ડી) કટ-ઓફ તારીખે જે સભ્યોનું નામ સભ્યોના રજિસ્ટિરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા લાભાર્થી માલિકોના રજિસ્ટિરમાં નોંધાયેલા છે માત્ર તેઓ જ રિમોટ ઇ-વોટિંગ અથવા બેલેંટ /પોલ દ્વારા એજીએમમાં મતદાનની સુવિધા મેળવવા માટે હકદાર થશે. c) એજીએમની સૂચના કંપનીની વેબસાઇટ www.disharesourcesltd.com અને સેન્ટલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા)લિમિટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે. ૯) ઇ-વોટિંગને લગતી માહિતી માટે સભ્યો એજીએમની સુચનામાં આપેલી સુચનાઓને અનુસરી શકે છે. અને ઇ-વોટિંગને સંબંધિત પ્રશ્નો કે ફરિયાદોના કિસ્સામાં, સભ્યો www.evotingindia.com પર વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ) સેકશન હેઠળ આપવામાં આવેલી માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકે છે. અથવા helpdesk.evoting@cdslindia.com ૫૨ ઇ-મેલ લખી શકે છે. અથવા ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ ૫૨ સંપર્ક કરી શકે છે. અથવા તો કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફિસર શ્રી ધ્વની નાગર, ૩, રાજેશ એપાર્ટમેન્ટ, અજંટા કોમ એસ્ટેટ પાછળ, ઓફ આશ્રમ રોડ,અમદાવાદ-૩૮૦૦૧૪ ખાતે સંપર્ક કરી શકે છે. અને ઈ-મેલ : disharesourceslimited@gmail.com પર ઇ-મેલ લખી શકે છે અથવા ૦૭૯-૨૭૫૪૦૭૯૦, ૨૭૫૪૩૦૬૦ પર સંપર્ક કરી શકે છે. ૫. કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૯૧ની જોગવાઈઓ અનુસાર, કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન)નિયમો,૨૦૧૪ના નિયમ ૧૦ સાથે વાંચતા અને તેનું પાલન કરતાં આગળ સૂચિત કરવામાં આવે છે કે કંપનીના સભ્યોનું રજિસ્ટર ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી (બંને દિવસ સહિત) બંધ રહેશે ૬. શ્રી ઉમેશ વેદ એન્ડ એસોસિયેટ્સ, જે કંપની સેક્રેટરીની પ્રેક્ટિસિંગ સ્કૂટિનાઇઝર તરીકે કરે છે તેમને કંપનીએ ઇ-વોટિંગ પ્રક્રિયાની નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચકાસણી કરવા માટે નિયક્ત કર્યા છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી દિશા રિસોર્સિસ લિમિટેડ માટે, ધ્વની નાગર સ્થળ : અમદાવાદ કંપની સેક્રેટરી તારીખ :૦૨-૦૯-૨૦૨૩ (એમ.નં.૭૧૧૫૮)

હોમ ફર્સ્ટ ફાચનાન્સ કંપની ઇન્ડિચા લિમીટેડ nomefirst CIN: L65990MH2010PLC240703 Website : homefirstindia.com, Phone No. 180030008425, Email ID : loanfirst@homefirstindia.com

પઝેશન નોટીસ

વિષચ : સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમ - ૨૦૦૨ હેઠળ સબ - નિચમ (૧) ના નિચમ ૮ હેઠળ પઝેશન નોટીસ

આથી, **હોમ ફર્સ્ટ ફાચનાન્સ કંપની ઇન્ડિયા લિમીટેડ** ના નીચે સહી કરનાર અધિક્રત અધિકારીએ સિકયોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટસ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (એકટ ૫૪ ઓફ ૨૦૦૨) તથા કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા નિયમ ૩ અંતર્ગત નીચે જણાવેલ ઉધારકર્તાઓના નામ અને બાકી લ્હેણી રકમ ને માંગણા નોટીસ જારી કરીને નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસોની અંદર બાકી રકમ સહિત ભરવા જણાવેલ હતું. તમે / ઉધારકર્તાઓ ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ ૧ ૩ની પેટા કલમ (૪) હેઠળ સિક્યુંરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ ૨૦૦૨ સાથે મળેલી સત્તાની રૂએ **હોમ ફર્સ્ટ ફાયનાન્સ કંપની ઇન્ડિયા લિમીટેડ** ના અધિકારીએ નીચે જણાવેલ મિલકતનો **કબજો** લઇ લીધેલ છે.

ક મ નં.	ઉદ્યારક્તાઓ અને સહ-ઉદ્યારક્તાઓ / જામીનદારોનું નામ	મોર્ગેજ મિલક્તોનું સરનામું	ਤੀਸਾਰਤ ਗੇਟੀસ ਗੀ તਾરੀਯ	ડીમાન્ડ નોટીસ મુજબની બાકી લ્હૈણી સ્ક્રમ (રૂા.માં)	પઝેશનની તારીખ
1.	લાડવા રમેશકુમાર, લાડવા જચશ્રીબેન	ફલેટ નં. ૨૦૬, બ્લોક - એન, દેવ નંદન સંકલ્પ સીટી, ૧૦૮ ઈસ્ટટીયુટ ની સામે, હંસપુરા રોડ, ૨૦૦ફુટ રીંગ રોડ, નરોડા, અમદાવાદ - ૩૮૨૩૩૦.	20-06-2023	9,37,531	28-08-2023
2.	મુરારીભાઈ સોની	ફલેટ નં. ૫૦૪, બિલ્ડીંગ - સી, કુશલ આવાસ, સર્વે નં. ૧૪૪૮, એફ.પી. નં. ૭૩, અયોધ્યા એપાર્ટમેન્ટની પાછળ, વટવા, અમદાવાદ - ૩૮૨૪૪૫.	06-05-2023	8,79,682	28-08-2023
3.	દિલીપ કાલુસિંઘ રાજપુત, ચશોદા દિલીપભાઈ રાજપુત	રો હાઉસ - ૯૫, ઉમા વિહાર, બ્લોક નં. ૩૧, રજીસ્ટ્રેશન નં. ૨૫, દાસ્તાન, પલસાણા, સુરત, સુરત - ૩૯૪૩૧૫.	20-06-2023	10,25,268	01-09-2023
ંઉધારકર્તા ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા / જામીનદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ રૂલ ૮ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ ઉપર જણાવેલ તારીખે મિલકતનો કબજો લઇ લીધેલ છે.					
ઉધારકર્તાઓ / જામીનદારોને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકતો / મુકરર એસેટ્સ અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકતો / મુકરર એસેટ્સ અંગે કરેલો કોઈપણ વ્યવહાર હોમ ફર્સ્ટ ફાચનાન્સ કંપની ઇબ્ડિચા લિમીટેડ ની ઉપર જણાવેલ બાકી રકમ તથા મિલકતો / મુકરર એસેટ્સ સામે તેની બાકી રકમ, ચડત વ્યાજ અને સંપૂર્ણ ચુકવણી ન થાય ત્યાં સુધી બોજાને આધીન રહેશે. "સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે ઉદારકર્તાઓનું મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."					

ક્શભ : ગેંઢકાવ તારીખ : 03.0૯.૨૦૨૩ Regd. Off.: 3, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006 Phone No. 91-79-26561000 website: www.mehtaintegratedfinance.com Email : mifl_in@yahoo.com

NOTICE OF 38TH ANNUAL GENERAL MEETING

The 38th Annual General Meeting ("AGM") of the Company will be held on Tuesday, 26th day of September, 2023 at 09:30 A.M., at 003 Law Garden Apartment, Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006

in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under and SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 read with Ministry of Corporate Affairs ("the MCA") vide its circular no. 10/ 2022 dated December 28, 2022 General Circular No, 14/2020 dated 08th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 and General Circular No. 20/2020 dated 5th May, 2020 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and SEBI (collectively referred as 'relevant circulars') to transact the business set out in the Notice calling the AGM.

In compliance with the relevant circulars, the Notice of the AGM and the Annual Report for the Financial Year 2022-23 will be sent to all the members in electronic mode whose e-mail addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid document will also be available on the Company's website www.mehtaintegratedfinance.com and on the website of the Stock Exchange

i.e BSE Limited at www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Manner of registering/updating e-mail addresses:

- a) Members holding shares in physical mode, who have not registered/updated their email addresses with the Company are requested to update/register the same by emailing to Company's Registrar & Share Transfer Agent i.e. Purva Sharegistry (India) Pvt Ltd at support@purvashare.com or at company's mail address i.e. mifl_in@yahoo.com
- Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses with the Depository Participants are requested to register/update their e-mail addresses with the Depository Participants with whom they maintain their demat accounts.

Manner of casting vote(s) through e-voting:

The Company is providing remote e-voting facility ("remote e- voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Detailed procedure for remote e- voting is provided in the Notice of AGM. Remote E-voting period starts at Friday, 22nd September, 2023 (09:00 A.M. IST) and ends at Monday, 25th September, 2023 (05:00 P.M. IST). The remote e-voting module will be disabled by National Securities Depository Limited (NSDL) for voting thereafter.

Book Closure Date & Cut-off Date:

- a) The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, 20th September, 2023 to Tuesday, 26th September, 2023 (both days inclusive) for the purpose of AGM, recommended by the Board of Directors for the financial year ended on 31st March, 2023.
- b) The cut-off date for determining the eligibility to vote by remote e-voting/e-voting at the AGM is Tuesday, 19th

September, 2023.

અધિકૃત અધિકારી, હોમ ફર્સ્ટ ફાચનાન્સ કંપની ઇન્ડિયા લિમીટેડ

Members are requested to carefully read the Notes set out in the Notice of the AGM and manner of casting vote through remote e- voting.

For Mehta Integrated Finance Limited Sd/Kamleshbhai P. Patel

ACS:10772

Date: 2nd september 2023 Company ecretary & ComplianceOfficer Place: Ahmedabad

આથી સેબી (એલઓડીઆર) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૪ કંપનીઝ ધારા, ૨૦૧૩ ની કલમ ૯૧ ના અનુસંધાનમાં એ નોટીર	9
રજીસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક્સ શનિવાર, ૨૩મી સપ્ટેમ્બર	. ૨૦૨૩ થી શનિવાર. ૩૦મી સપ્ટેમ્બર.
૨૦૨૩ (બંને દિવસો સહિત) એજીએમના હેતુસર બંધ રહેશે.	, , , , ,
	બોર્ડના આદેશ થી,
	શુભમ પોલિસ્પીન લિમિટેડ માટે
	સહી/-
સ્થળઃ બોરીસણા	અંકિત અનિલ સોમાણી
તારીખઃ ૧લી સપ્ટેમ્બર, ૨૦૨૩	(ડીઆઈએનઃ 05211800)
maine in a crit, 2020	A

ચેરપર્સન અને મેનેજીંગ ડાયરેક્ટર

શાંતાઈ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ CIN No.: L74110GJ1988PLC013255 રજી.ઓફિસ : ૮ ૨૦, ગોલ્ડન પોઇન્ટ, ટેલિફોન એક્ષચેન્જ પાસે, બેગમપુરા, ફાલસાવાડી, રીંગ રોડ, સુરત-૩૯૫૦૦૩.

વેબસાઇટ : www.shantaiindustrieslimited.com ઇ-મેલ : shantaiindustriesltd@gmail.com ફોન નંબર : ૯૯૧૩૪૨૫૦૦૦

વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ની નોટિસ

બાથી સૂચના આપવામાં આવે છે કે શાંતાઈ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના સભ્યોની ૩૮મી વાર્ષિક સામાન્ય સભા સોમવાર, રપમી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૪.૩૦ (આઈએસટી) વાગ્યે એજીએમની સૂચના મુજબ વ્યવસાયનો વ્યવહાર કરવા ૮૨૦, ગોલ્ડન પોઇન્ટ, ટેલિફોન એક્ષચેન્જ પાસે, બેગમપુરા, ફાલસાવાડી, રીંગ રોડ, સુરત-૩૯૫૦૦૩. ખાતે યોજાશે.

બુક ક્લોઝર અને ઇ-વોટિંગ

. રેજીએમના હેતુ માટે કંપનીના તમામ શેરધારકોને જાણ કરવામાં આવે છે કે કંપનીનું સભ્યોનું રજિસ્ટર મંગળવાર, ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી સોમવાર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) બંધ રહેશે. ઈ-વોટિંગના હેતુ માટે કટ-ઓફ તારીખ સોમવાર, ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ છે.

આથી તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે :

ા. એજીએમની સૂચનાની ઇલેકટ્રોનિક નકલો એવા તમામ સભ્યોને મોકલવામાં આવી છે કે જેમના ઇ-મેલ આઈડી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ સાથે નોંધાયેલા છે. એજીએમની સૂચનાની ભૌતિક નકલો અન્ય તમામ સભ્યોને મના નોંધાયેલા સરનામા ઉપર મોકલી આપેલ છે. એજીએમની નોટિસ રવાનગીનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું છે. એજીએમની તોટિસ કંપનીની વેબસાઇટ www.shantaiindustrieslimited.com ઉપર ઉપલબ્ધ છે.

ર. ૧મી સપ્ટેમ્બર, ૨૦૨૩ કટ-ઓફ તારીખ મુજબ, ભૌતિક સ્વરૂપમાં કે ડીમેટ સ્વરૂપમાં શેર ધરાવતાં સભ્યો, એનએસડીએલની ઇલેકટ્રોનિક વોટિંગ સિસ્ટમ દ્વારા એજીએમની સૂચનામાં નિર્ધારિત વ્યવસાય પર એજીએમ (રિમોટ ઇ-વોટિંગ)ના સ્થળ સિવાયનું સ્થળેથી ઇલેકટ્રોનિક રીતે તેમનો મત આપી શકે છે. તમામ સભ્યોને જાણ કરવામાં આવે

૧) એજીએમની સૂચનામાં નિર્ધારિત વ્યવસાયો ઇલેકટ્રોનિક માધ્યમથી મતદાન દ્વારા વ્યવહાર કરી શકે છે. ૨) રિમોટ ઇ-વોટિંગ શુક્રવાર, સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૩ના રોજ સવારે ૯-૦૦ ક્લાકે શરૂ થશે. ૩) રિમોટ ઇ-વોટિંગ રવિવાર, સપ્ટેમ્બર ૨૪, ૨૦૨૩ના રોજ ૧૭-૦૦ કલાકે સમાપ્ત થશે. ૪) ઇલેકટોનિક માધ્યમથી અથવા એજીએમમાં મતદાન કરવાની પાત્રતા નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ ૧૮મી સપ્ટેમ્બર. ૨૦૨૩ છે.

પ) કોઈપણ વ્યક્તિ કંપનીને શેર મેળવે છે, અને એજીએમની નોટિસ મોકલ્યા પછી કંપનીના સભ્ય બને છે તથા કટ-ત્રોફ તારીખે એટલેકે ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી શેર ધરાવે છે તેઓ evoting@nsdl.co.in પર વિનંતી મોકલીને લોગઇન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કોઈ પહેલેથીજ ઇ-વોટિંગ માટે એનએસડીએલ સાથે નોંધાયેલ હોય તો મત આપવા માટે વર્તમાન યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકાય છે. જે વ્યક્તિ કટ-ઓફ તારીખે સભ્ય નથી તેઓએ એજીએમની સૂચનાને માત્ર માહિતીના હેતુ માટે ગણવી જોઈએ.

૬) સભ્યો નોંધ કરો કે (એ) એનએસડીએલ દ્વારા મતદાન માટેની ઉપરોંક્ત તારીખ અને સમય પછી રિમોટ ઇ-વોટિંગ મોડ્યુલને અક્ષમ કરવામાં આવશે અને એક વખત સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવે તે પછી સભ્યને તેને બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. (બી) મતદાન પેપર દ્વારા કરવાની સુવિધા એજીએમમાં ઉપલબ્ધ કરવામાં આવશે. (સી) જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઇ-વોટિંગ દ્વારા તેમનો મત આપેલ છે તેઓ પણ એજીએમમાં હાજરી આપી શકશે પરંતુ તેઓ ફરીથી મતદાન માટે હકદાર રહેશે નહીં. અને (ડી) જે વ્યક્તિનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દારા કટ-ઓફ તારીખે જાળવવામાં આવેલા લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલ હોય તેઓ જ માત્ર એજીએમ દરમિયાન એજીએમમાં આપેલ સૂચના મુજબ રિમોટ ઇ-વોટિંગ તેમજ મતદાનની સવિધા મેળવવા માટે હકદાર રહેશે.

9) ઈ-વોટિંગ સંબંધિત કોઈપણ પ્રશ્નો હોય અથવા સમસ્યાઓના કિસ્સામાં તમે www.evoting.nsdl.com પર મદદ વિભાગ હેઠળ ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો (એકએક્યુ) અને ઇ-વોટિંગ મેન્યુલનો સંદર્ભ લઈ શકો છો. અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૦૨૦-૯૯૦ પર ફોન કરી શકો છો અથવા (સુશ્રી સરિતા મોટે)ને evoting@nsdl.co.in પર વિનંતી મોકલી શકો છો.

સ્થળ : સુરત તારીખ : ૦૨/૦૯/૨૦૨૩	બોર્ડનો આદેશથી શાંતાઈ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ માટે, સહીં
	કોમલ અગ્રવાલ કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફિસર